



રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.

(A subsidiary company of Rajkot Municipal Corporation)

જાહેરખબર ક્રમાંક:૦૧/૨૦૧૯-૨૦



રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.(RSCDL) માટેનીચે મુજબની જગ્યાઓ કરાર આધારીત ૧૧ માસનાં કરારથી ભરવા માટે તા.૦૪/૧૦/૨૦૧૯ થી તા.૧૮/૧૦/૨૦૧૯સાંજનાં ૬:૦૦ કલાક સુધીમાં રૂમ નં.૧૦ પ્રથમ માળે,વેસ્ટ ઓન કચેરી, બીગ બજારની પાછળ, ૧૫૦' રીંગ રોડરાજકોટ મહાનગરપાલિકા,રાજકોટ-૩૬૦૦૦૫ ખાતે મોકલી આપવાની રહેશે.

Sr. No.	Designation	Qualification	Experience	Monthly Remuneration	No of post.
1	Dy. General Manager (Electrical, District Cooling System, Power)	Candidate should be a Masters in Electrical Engineering (Minimum 60% and above) from a reputed institution/University or Post Graduate in Project Engineering and Management with Basic qualification of B.Tech/B.E. in Electrical Engineering.	<ul style="list-style-type: none"> The candidate should have previously worked in a similar role for a minimum of 10 years. Should have worked in infrastructure sector for minimum of 5 years in a responsible capacity. Knowledge in District Cooling System and Solar Plans is added advantage and preferable. Led a public or private sector infrastructure service organization in India or abroad Strong understanding of and diversity of experience in infrastructure services Strong understanding of working with central/state/local governments in India. 	Rs. 35,000 to 75,000	1
2	Programmer Cum Web Developer	Bachelors in (Engineering/Tech) in (Computer/I.T.) from a recognized university (Minimum 60% and above)	Minimum 3 yearsexperience as Programmer cum Web Developer	Rs.35,000 to 42000	1
3	Account Officer	B. Com with M. Com or MBA (Finance)	<ul style="list-style-type: none"> Minimum 5 years and above Necessary competencies: - Certified Tally ERP 9.0 and Basic Computer Knowledge 	Rs. 35,000 to 40,000	1
4	Assistant Manager ICT & Smart City Centre (ICCC)	<ul style="list-style-type: none"> Bachelor in Computer Science/ Electronics / IT or equivalent from a recognized and reputed university/ institute (Minimum 60% and above) MCA or equivalent from a recognized and reputed university/ institute with minimum 2 years' experience Additional Certification course and/or MBA / M.E./Tech. will be an added advantage from a recognized and reputed university/ institute 	<ul style="list-style-type: none"> Relevant experience in implementing and providing technical support for digital solutions of working / supporting GoI /State Government/ ULB or similar institution environment in end to end implementation of ICT centric e-governance/ Mission mode projects. Experience in preparation of technical solutions for the ICT related infrastructure services /e-services, etc. Should have experience of at least two city-wide/ state-wide/ Nation-wide ICT project implementation in the capacity of Manager-Technical / IT and above. Global exposure and/or working in a smart city environment will be an added advantage. Deep Knowledge of managing day to day ICT operation in a Smart city /Safe city/Command and control system/ city wide ICT infrastructure environment Operational Knowledge of integration of various technologies and Applications in ICT domain from disparate sources with varying standards Good understanding of emerging technologies and frameworks like IoT, Big data analytics, Artificial Intelligence, Block Chain, cyber security etc. and developing innovative & smart urban solution based on above Strong motivation to learn new technologies. Extensive knowledge of Date/network security, Software applications in e-governance, Voice/ Video/ data domain 	Rs.35,000 to 40,000	1
Age Limit Maximum 45 years for All Post					

:-ઉપરોક્ત જગ્યા માટે અરજીફોર્મ ભરતી વખતે ઉમેદવારે ધ્યાને લેવાની અગત્યની સુચનાઓ:-

- ૧.નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી ફોર્મમાંસ્વહસ્તે વિગતો ભરીને જરૂરી આધાર પુરાવા(પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ) સાથેરજીસ્ટર્ડ પોસ્ટ થી જમા કરાવવાની રહેશે.ચકાસણી દરમ્યાન નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોનાં અરજીફોર્મરદબાતલ ગણવામાં આવશે.
૨. ઉંમર,શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ ગણવામાં આવશેતેમજ તેના આધાર પુરાવા તરીકે અરજી ફોર્મ સાથે નકલ જોડવાની રહેશે.
૩. જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત/ડીગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. તે પહેલાનો અનુભવ કોઇપણ સંજોગોમાં માન્ય ગણાશે નહિ. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે અનુભવનાં પુરાવા તરીકે ઉમેદવારે જે તે માન્ય સંસ્થાનું ઇન્વર્ડ/આઉટવર્ડ નંબર તથા તારીખ સહિતનું જ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવનાં પુરાવા તરીકે માન્ય ગણાશે નહી. પરંતુ જો તેની સાથે વખતોવખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાકા કે પ્રમોશનના હુકમ,પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કર્યેથી,તેની પૂરતી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાયેથી આવો અનુભવ માન્ય ગણવામાં આવશે. અનુભવ બાબતે વિસંગતતા જણાશે તેવા કિસ્સામાં અનુભવ માન્ય/અમાન્ય ગણવા અંગે ચેરમેનશ્રી,રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નો નિર્ણય આખરી ગણાશે.
૪. ઉમેદવારે વેબસાઇટ(www.smartcityrajkot.in)અને(www.nc.gov.in)પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અરજી ફોર્મમાં દર્શાવેલ વિગતો સ્વહસ્તે ભરવાની રહેશે. જેમા પાછળથી કોઇપણ સંજોગોમાં ફેરફાર કરવા દેવાશે નહી.
૫. ઉમેદવારે અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઇલ નંબર તથા ઇ-મેઇલએડ્રેસ લખવા અનિવાર્ય છે, જે ઉપર ભવિષ્યમાં ભરતી સંબંધિત સંદેશા આપી શકાય. યોગ્ય મોબાઇલ નંબરતથા ઇ-મેઇલ એડ્રેસદર્શાવેલ ન હોય તેવા ઉમેદવારને સંદેશો ન પહોંચે તે અંગે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નીકોઇ જવાબદારી રહેશે નહી.
૬. સદરહુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે લાયક ઉમેદવારોને જલેખીત/ઇ-મેઇલથી પત્રવ્યવહાર કરવામાં આવશે. જેની નોંધ લેવી. ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની

(www.smartcityrajkot.in) અને (www.mc.gov.in) જોતા રહેવા વિનંતી છે.

૭. માર્કશીટ, ડીગ્રી સર્ટીફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકાવારી દર્શાવતું માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન સર્ટીફિકેટરજુ કરવાનું રહેશે.
૮. વિવાહિત મહિલા ઉમેદવાર જો તેમના નામની પાછળ પિતાને બદલે પતિના નામ સાથે અરજી કરવામાંગતા હોય તો તેમણે લગ્ન રજીસ્ટ્રેશનની નકલ અસલ પ્રમાણપત્રઘન્ટરવ્યુ સમયે ફરજિયાતપણે રજૂ કરવાનું રહેશે.
૯. ઉમેદવારોએ ઘન્ટરવ્યુ માટે સ્વખર્ચે આવવાનું રહેશે.
૧૦. કોઇપણ ઉમેદવારની પસંદગી કરવા કે ન કરવા તે માટેનાં અધિકારો સક્ષમસત્તા દ્વારા નક્કી કરેલ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ની સ્ટાફ સિલેક્શન કમિટી પાસે અબાધિત રહેશે અને આ કમિટીનો નિર્ણય આખરી રહેશે.
૧૧. પસંદગી પામેલ ઉમેદવારની નિમણુંક ચેરમેનશ્રી, રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. ઠરાવે તે શરતોને આધિન રહેશે.
૧૨. ઉમેદવારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અરજી ફોર્મમાં ભરેલ વિગતોમાં કોઇપણ વિગત ખોટી દર્શાવેલ હશે અથવા ભરતી પ્રક્રિયાના કોઇપણ તબક્કે ખોટી માલૂમ પડશે તો તેમની અરજી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે તથા તેણે લાયકીધોરણ (Passing Standard) મેળવેલ હશે તો પણ તેમની ઉમેદવારી રદ ગણાશે. તેમજ ભવિષ્યમાં પણ ઉમેદવારે નિમણુંક સમયે રજૂ કરેલ જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ અને અન્ય પુરાવા ખોટા માલૂમ પડશે કે શંકાસ્પદ જણાશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા ઉમેદવારની પસંદગીથી નિમણુંક થયેલ હશે તો પણ તાત્કાલિક અસરથી નિમણુંક રદ કરવામાં આવશે.
૧૩. સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીનાં સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારની ગેરલાયકાતમાં પરિણમશે.
૧૪. આપેલ જાહેરખબર કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેવા સંજોગોમાં તેમ કરવાનો ચેરમેનશ્રી, રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ને સંપુર્ણ

હક્ક/અધિકાર રહેશે અને રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

૧૫. ઉક્ત દર્શાવેલ જગ્યા ઉપર ફીક્સ મહેનતાણું કરાર આધારિત નિમણુંક પામનાર ઉમેદવારને રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા નક્કી કરવામાં આવેલ બોલીઓ અને શરતોને આધિન કરાર/બોન્ડ કરવાનો રહેશે.

---- ✍-----

(સહી/-) મુખ્ય કારોબારી અધિકારી
રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.



Rajkot Smart City Development Ltd.-**RSCDL**
(A subsidiary company of Rajkot Municipal Corp.)
Advt No:01/2019-20 Recruitment Advertisement



Applications are invited for the post of (1) Deputy General Manager-(Electrical, District Cooling System, Power)- 1 (2) Programmer Cum Web Developer-1 (3) Account Officer-1 (4) Assistant Manager ICT & Smart City Centre (ICCC) -1 on contractual basis (11 months) for RSCDL. Interested candidates will have to download the application form and other details like Age, Qualification, Experience etc. from www.rmc.gov.in & www.smartcityrajkot.in and submit the filled application to "The General Manager, RSCDL, Room No. 10, 1st Floor, RMC West Zone Office, B/h Big Bazaar, Rajkot-360005." with the envelope clearly mentioning "**Application for the Above Post**" from 04/10/19 to 18/10/19 upto 18:00 Hours only.

S/d, CEO -RSCDL

[illegible]

Experience Details:

Sr. No.	Organization/Company Name	Designation	Pay Matrix	Experience Duration
Other Details (If Any)				

: Declaration:

I hereby confess that all the above statements are true and complete. If it is found to be false then my candidature is subject to cancellation and any action taken against me by Rajkot Smart City Development Ltd. will be completely binding on me. I hereby commit to writing in compliance with all the current and frequently used rules of Rajkot Smart City Development Ltd.

Date: _____
Place: _____

Candidate Signature: _____
Candidate Name: _____

Note: A certified copy of age, educational qualification, experience and other certificates along with this application form should be sent along with the details as indicated in the notification.